

ઑંગલવૂડ હોસ્પિટલ ઍન્ડ મેડિકલ સેન્ટર		નં.: 400.35
નીતિ અને કાર્યપ્રણાલીની પરિચય પુસ્તિકા - વિભાગ	વિષય:	તારીખ: 1/1/2016
વહીવટી અને સહાયક સેવાઓ	નાણાકીય સહાય નીતિ	પાનું 1 કુલ 2
		નું સ્થાન લીધું: નવું
		સમિક્ષા કરી:

નીતિ

ઑંગલવૂડ હોસ્પિટલ ઍન્ડ મેડિકલ સેન્ટર (ઈએચએમસી) બંધા દર્દીઓને, પૈસા ચૂકવવાની તેમની ક્ષમતાને ધ્યાનમાં લીધા વગર તમામ તાત્કાલિક અને તબીબી રીતે જરૂરી સારવાર આપે છે. N.J.S.A. §26:2H-12.52માં “કેટલાક વીમા કવચ વિનાના દર્દીઓ માટે ખર્ચ પર મર્યાદા” અંગે દર્શાવેલ બિલિંગ માર્ગદર્શિકાઓનો સ્વીકાર અને તેનું વિસ્તરણ ઈએચએમસીએ કરેલ છે અને તે વીમા કવચ વિનાના તમામ દર્દીઓને, તેમની આવક ધ્યાનમાં લીધા વગર, નાણાકીય સહાય કરે છે. આ નીતિ માત્ર ઑંગલવૂડ હોસ્પિટલ અને મેડિકલ સેન્ટર દ્વારા આપવામાં આવતી તમામ તબીબી રીતે જરૂરી સારવાર અને તાત્કાલિક તબીબી સેવાઓને લાગુ થાય છે અને એ સારવાર સાથે સંકળાયેલી કોઈ પણ વ્યાવસાયિક સેવાઓને લાગુ થતી નથી.

કાર્યપ્રણાલી

- મેડિકેડ ચેરિટી કેર (જુઓ ન્યુ જર્સી હોસ્પિટલ કેર પેમેન્ટ અસિસ્ટન્સ પ્રોગ્રામ / ચેરિટી કેર પોલિસી) માટે મંજૂર ના થયા હોય એવા તમામ વીમા કવચ વિનાના દર્દીઓનું બિલ તેમના કુલ ચાર્જિસના કેટલાક ટકા કિંમતનું બનાવવામાં આવે છે. રાજ્ય કાયદાની જરૂરિયાત મુજબ, આ ઘટાડો ઈએચએમસીના મેડિકેર દરોના 11% જેટલો હોય છે. ઈએચએમસી બિલની રકમ નિર્ધારિત કરવા માટે લુક બેક પદ્ધતિનો ઉપયોગ કરે છે. જેમાં તમામ મેડિકેર ચૂકવણીના સરવાળાને પાછલા 12 મહિનાના સમયગાળામાં મેડિકેર કુલ ખર્ચના સરવાળા દ્વારા વિભાજિત કરવામાં આવે છે. એમાં અપવાદ એવી બાબતોનો છે, જ્યારે કોસ્મેટિક સર્જરી જેવી કેટલીક પ્રક્રિયાઓ તબીબી રીતે આવશ્યક હોતી નથી અને તેનો ખર્ચ દર્દી દ્વારા ભોગવવાનું પહેલાથી નક્કી કરેલ હોય છે.
- ઈએચએમસી, આયઆરએસ કલમ 501(r) નિયમો મુજબ ઉપર #1 માં વ્યાખ્યાયિત કરેલ અને ગણી કાઢેલ ટકાવારીની સરખામણી 501(r)માં વર્ણિત “લુક બેક” પદ્ધતિ સાથે કરશે. તેમાં તમામ દર્દીઓના ડેટાનો ઉપયોગ કરાશે અને બેમાંથી જે વધારે હોય તેટલા ટકા વળતર દર્દી માટે રાખવામાં આવશે. 501(r) અનુસાર, વીમા કવચ રહિત સેવાઓ પર લાગુ થનાર વળતરની ટકાવારી નક્કી કરવા માટે દરેક સેવા માટે અલગ અલગ ગણતરી કરવામાં નથી આવતી પણ એકંદર ગણતરી કરવામાં આવે છે. આ ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે અને કેલેન્ડર વર્ષની સમાપ્તિ બાદ વધારેમાં વધારે 60 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે છે.
- વીમા કવચ વિનાના દર્દીઓએ નાણાકીય સહાય માટે અરજી કરવાની જરૂર નથી કારણ કે એવા તમામ દર્દીઓના બિલ, ઉપર #1 માં જણાવ્યા મુજબ, કુલ બિલના કેટલાક ટકા સુધી આપમેળે ઘટાડવામાં આવે છે. તે માટે લાયકાતનો કોઈ માપદંડ નથી. માત્ર, દર્દીનો વીમો હોવો જોઈએ નહીં અને મેળવેલ સેવા અગત્યની અને તબીબી રીતે અનિવાર્ય હોવી જોઈએ.
- જો દર્દીની વીમા કંપની નીચેના કારણોથી તેની અરજીનો અસ્વીકાર કરે: લાભો ખાતમ થઈ ગયા છે, પ્રયોગાત્મક, તબીબી જરૂરિયાત, પહેલાથી અસ્તિત્વમાં રહેલ સ્થિતિ, આવરી લેવામાં ના આવેલ ચાર્જિસ, વગેરે. તો દર્દીનું બિલ, ઉપર #1 માં જણાવ્યા મુજબ, કુલ બિલના વીમા કવચ વિનાના દરના કેટલાક ટકા સુધી ઘટાડવામાં આવશે.
- ઈએચએમસી ખાતે ન્યુ જર્સી હોસ્પિટલ કેર પેમેન્ટ અસિસ્ટન્સ પ્રોગ્રામ / ચેરિટી કેર દ્વારા મદદની અરજી કર્યા બાદની કાર્યપ્રણાલી જાણવા માટે ન્યુ જર્સી હોસ્પિટલ કેર પેમેન્ટ અસિસ્ટન્સ પ્રોગ્રામ / ચેરિટી કેર નીતિ જુઓ.

ઁંગલવૂડ હોસ્પિટલ ઁન્ડ મેડિકલ સેન્ટર		નં.: 400.35
નીતિ ઁને કાર્યપ્રણાલીની પરિચય પુસ્તિકા - વિભાગ વહીવટી ઁને સહાયક સેવાઓ	વિષય: નાણાકીય સહાય નીતિ	તારીખ: 1/1/2016
		પાનું 2 કુલ 2
		નું સ્થાન લીધું: નવું
		સમિક્ષા કરી:

- 6) ઈએચએમસી બિલિંગ ઁને વસૂલી પ્રક્રિયાઓ માટે બિલિંગ ઁને વસૂલી નીતિ જુઓ.
- 7) આ નીતિની નકલ (હાર્ડ કૉપી) નાણાકીય સલાહ વિભાગમાં તેમજ મેડિકલ સેન્ટરના પેશન્ટ ઁક્સેસ ક્ષેત્રમાં ઁને તમામ ઈએચએમસી ઁફિસાઈટ સ્થળોઁ પણ ઉપલબ્ધ ઁ. આ નીતિ ઁંગલવૂડ હોસ્પિટલ ઁને મેડિકલ સેન્ટરની વેબસાઈટ www.inglewoodhealth.org પર પણ ઉપલબ્ધ ઁ.

	દ્વારા મંજૂર:
	વૉરેન ગેલર, પ્રમુખ ઁને સીઈઓ